



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૪/૦૫/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૪ વ્યક્તિઓને ઝડપી, ૧૦૮ લીટર દેશી દારૂ, ૧૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૦ બીયરટીન, ૫૦ બીયર બોટલ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૬,૫૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અને પ્રોહી.૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૮૩૫/૧૯

કારંજ : જયેશભાઈ દેવશીભાઈ મોઢવાડીયા (ઉ.વ.૨૮)(રહે.ગામ-બોખીરા, કુલવાડી, તા.જિલ્લો- પોરબંદર) એ તા.૧૩/૮/૧૯ નારોજ કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ડીસેમ્બર/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન સોનીયાબહેન શીરાવાલા (રહે.અલરશીદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, સીટી પોઇન્ટ, ઇટાલીયન બેકરીની સામે ભદ્ર લાલદરવાજા) એ જયેશભાઈ ને તથા અન્ય સભ્યોને દુબઇ તથા કેનેડા મોકલવા વર્ક વિઝનું કામ કરી આપવાનો વિશ્વાસ આપી, જયેશભાઈ તથા બીજા સભ્યો પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦/- તથા પાસપોર્ટ મેળવી લઇ, વર્ક વિઝનું કામ નહીં કરી તેમજ નાણા અને પાસપોર્ટ પરત નહીં આપી, તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આઇ.મકરાણી ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૮૩૬/૧૯

નવરંગપુરા : શાહનવાઝ આસીફમીયા શેખ (ઉ.વ.૨૧)(રહે,ઈરફાન પાર્ક, ઉસ્માન હાઇની સોસાયટી પાસે, વેજલપુર) એ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૫/૨૦૧૯ સાંજના ૫/૩૦ થી તા.૧૩/૦૫/૨૦૧૯ સવારના ૮/૦૦ વાગ્યા દરમિયાન નવરંગપુરા, હોટલ પુનમ પેલેસ ની બાજુમા આવેલ પોતાની "ઈકોમ એક્સપ્રેસ કુરીયર કંપની" ની ઓફીસના મુખ્ય દરવાજાનું તાળુ તોડી કે ડુપ્લીકેટ ચાવીથી ખોલી ઓફીસની તિજોરીમાંથી રોકડ રૂપિયા ૮૮,૧૭૯/- ચોરી કરી લઈ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી પી.બી.દેસાઇ ચલાવે છે.

અપમૃત્યુ :-

સમાચાર યાદી નં.૮૩૭/૧૯

ઓઢવ : મિતેષ કનુસિંહ સોલંકી (ઉ.વ.૨૦)(રહે.શકિતનગર જનતાનગરની સામે ઓઢવ ગામ) તા.૦૧/૦૫/૧૯ સાંજના ૪/૩૦ વાગ્યાના સુમારે ઓઢવ ઉદય એસ્ટેટ જે.કે.સ્ટીલ ની કંપનીમાં કામ કરતી વખતે, ચાલુ લીફ્ટમાં મોઢુ બહાર કાઢતા, ઢિવાલ થી અને લીફ્ટના ઝાંપાથી મિતેષ ને મોઢાના ભાગે ઇજા થતા, સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ઢાખલ કરેલ હતા. જ્યાં સારવાર ઢરમ્યાન તા.૧૩/૦૫/૧૯ ના કલાક ૧૦/૦૦ વાગે ફરજ પરના ડો. શ્રી એ મિતેષને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી જીવસિંહ તીતસિંહ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૮૩૮/૧૯

ઓઢવ : વૈશાલીબેન વા/ઓ ઋષીકેશ રામઢાર કડવ(મરાઢી) (ઉ.વ.૨૫)(રહે.પાશ્વનાથ સોસાયટી અંબીકાનગર ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૧૩/૦૫/૧૯ ના કલાક ૦૬/૦૦ થી કલાક ૦૭/૦૦ વાગ્યા ઢરમ્યાન પોતાના ઘરે છતના ભાગે ઢુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી “આઇ” ડીવીઝન નાઓ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાઢ શહેર.  
પોલીસ કમિશનર વતી.